

Basant Mela (Gujarati)



# બસાંત મેલા



શૈબે તરીકત, અમીરે અહલે સુન્નત, જાલિયે દા'વતે જરવામી, હાજરત અલવામા મૌલાના અબૂ ઝિલાલ

મુહમ્મદ ઇબ્રાહમ અતાર કાદિરી ર-ઝવી

کامت برکات  
الکتابیہ

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ  
 مَا بَعُدَ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ  
**કિતાબ પઢને કી દુઆ**

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નાત, બાનિયે દા'વતે ઇસ્લામી, હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ દીની કિતાબ યા ઇસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી હુઈ દુઆ પઢ લીજિયે إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ જો કુઈ પઢેગે યાદ રહેગા. દુઆ યેહ હે :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ  
 عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા : ઐ અલ્લાહ عَزَّوَجَلَّ ! હમ પર ઇલ્મો હિક્મત કે દરવાઝે ખોલ દે ઓર હમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અ-ઝમત ઓર બુરુગી વાલે । المستطرف ج ١ ص ٤٠٤ دار الفكر بيروت  
 નોટ : અલ્લ આબિર એક એક બાર દુરૂદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે મદીના  
 વ બકીઅ  
 વ મગ્ફિરત  
 13 શલ્વાલુલ મુકર્રમ 1428 હિ.



## બસન્ત મેલા

યેહ રિસાલા (બસન્ત મેલા)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નાત, બાનિયે દા'વતે ઇસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ઝિયાઈ دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ ને ઉદ્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હે.

મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી) ને ઇસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ ક્રિયા હે ઓર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હે. ઇસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએં તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ મક્તૂબ, ઈ-મેઇલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

**રાબિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઇસ્લામી)**

મક-ત-બતુલ મદીના, સિલેક્ટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને,  
 તીન દરવાઝા, અહમદઆબાદ-1, ગુજરાત, ઈન્ડિયા

MO. 9374031409 E-mail : translationmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

# બસન્ત મેલા

યેહ રિસાલા (23 સફહાત) મુકમ્મલ પઠ કર ખુદ કો ઓર દૂસરે  
મુસલ્માનોં કો અઝાબે ઇલાહી સે બયાને કી તદાબીર કીજિયે.

## દુરૂદ શરીફ કી ફઝીલત

સરકારે નામદાર, મદીને કે તાજદાર, હબીબે પરવર દગાર,  
શફીએ રોઝે શુમાર, જનાબે અહમદે મુખ્તાર صَلَّی اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા  
ઈશાદિ નૂરબાર હૈ : “તુમ અપની મજલિસોં કો મુઝ પર દુરૂદે પાક પઠ કર  
આરાસ્તા કરો ક્યૂંકે તુમ્હારા મુઝ પર દુરૂદે પાક પઠના બરોઝે કિયામત તુમ્હારે  
લિયે નૂર હોગા.”

(فردوس الاخبار ج ۱ ص ۴۲۲ حدیث ۳۱۴۹)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

## બસન્ત મેલા

જૂં હી સર્દી કા ઝોર ટૂટતા ઓર (ફરવરી મેં) મૌસિમે બહાર  
કી આમદ હોતી હૈ મર્કઝુલ ઓલિયા લાહોર, સરદારઆબાદ  
(ફેસલઆબાદ), રાવલ પિન્ડી, ગોજરાંવાલા ઓર પાકિસ્તાન કે કઈ  
છોટે બડે શહરોં મેં “બસન્ત” કે નામ પર નાયરંગ કી મહફિલેં  
સજાઈ જાતીં, શરાબેં પી જાતીં ઓર ખૂબ પતંગ બાઝી કે મેલે સજાએ

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : جيس نے मुज पर ओक बार दुइटे पाक पढा अदलाउ उस पर दस रउमतें बेजता है. (स्म)

જાતે હેં જિસ મેં હમારે બે શુમાર મુસલ્માન ભાઈ નફસો શૈતાન કે બહકાવે મેં આ કર બે તહાશા ગુનાહ કરતે ઓર કરોડોં રુપૈ હવા મેં ઉડા દેતે હેં, ઉમૂમન યેહ સિલ્સિલા માર્ય કે આખિર તક જારી રહતા હૈ.

## બસન્ત મેલા એક ગુસ્તાખે રસૂલ કી યાદગાર હૈ !

મેરે ભોલે ભાલે ઈસ્લામી ભાઈયો ! ક્યા આપ જાનતે હેં કે “બસન્ત મેલે” કા આગાઝ ક્યૂં ઓર કેસે હુવા ? દિલ પર હાથ રખ કર સુનિયે કે યેહ એક ગુસ્તાખે રસૂલ કી યાદગાર હૈ ! જી હાં તકસીમે હિન્દ સે ભી કાફી પહલે સિયાલ કોટ કે એક ગૈર મુસ્લિમ ને હમારે પ્યારે પ્યારે આકા મક્કી મ-દની મુસ્તફા صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم ઓર શહજાદિયે કૌનૈન સય્યિ-દતુના બીબી ફાતિમા رَضِيَ اللہُ تَعَالٰی عَنْہَا કી શાને અ-ઝમત નિશાન મેં મૈલ્લા ગુસ્તાખી કી, આશિકાને રસૂલ બે કરાર હો ગએ જો કે એક ફિત્રી અમ્ર થા, મુજરિમ ગિરિફતાર કર લિયા ગયા ઓર ઉસે મર્કઝુલ ઓલિયા લાહોર લા કર કોર્ટ મેં મુજરિમોં કે કટહરે મેં ખડા કર કે સજાએ મૌત સુના દી ગઈ, ઓર ફિર ઉસ ગુસ્તાખે રસૂલ કો કેફરે કિરદાર તક પહોંચા દિયા ગયા. ઉસ કી મૌત પર ગૈર મુસ્લિમોં મેં સફે માતમ બિછ ગઈ ! ઉન કે એક રઈસ ને ઉસ ગુસ્તાખે રસૂલ કે “યૌમે હલાકત” કી યાદ તાજા રખને કે લિયે મૌસિમે બહાર “બસન્ત મેલે” કી બુન્યાદ રખી ઓર ફિર હર સાલ મેલા મનાયા જાને લગા<sup>1</sup>..... સદ કરોડ અફસોસ ! કે નફસો શૈતાન કી ચાલ મેં આ કર કુછ મુસલ્માન ભી ઈસ કી તરફ માઈલ હો ગએ, બસન્ત મેલા જારી

<sup>1</sup> مدینہ

1 : Punjab under the later Mughals, s. 279, મત્બૂઆ લાહોર, રોઝનામા નવાએ વક્ત 4 ફરવરી 1994 ઈ. બિત્તસરફ

ईरमाने मुस्तफ़ा صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : जो शरिफ़ मुज पर दुइद पाक पढना भूल गया वोह जन्त का रास्ता भूल गया. (جران)

करने वाले तो कत्मी के मर भप कर मिट्टी में मिल गये मगर अपनी यकीनी और अटल मौत से गाड़िल मुसल्मानों ने इस मेले को जारी रखने में अपना किरदार अदा किया, बिल आपिर वोह त्मी मौत का जाम गट-गटा कर अंधेरी क़भ की सीढी उतर गये मगर अफ़सोस ! सद् करोड अफ़सोस ! बसन्त मेले का गुनाहों त्मरा सिक्सिला अब त्मी हमारे मुसल्मान भाईयों में अपनी तमाम तर हलाकत सामानियों के साथ भूब नुहूसतें लुटा रहा है.

### पतंग उड़ाने, पेय लडाने, पतंग और डोर लूटने और बेयने का शर-ई हुकम

“बसन्त मेले” में पतंग और डोर बेयने, भरीदने, उड़ाने, पेय लडाने और कटी लुई पतंग लूटने को बुन्यादी हैसियत हासिल होती है, यकीनन येह काम अल्लाह व रसूल صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم को पुरश करने वाले नहीं हैं. इतावा र-जविया जिल्द 24 सफ़हा 660 पर है : कन्कय्या (या'नी पतंग) लूटना हराम, और भुद आ कर गिर जाये तो उसे फ़ाड डाले, और अगर मा'लूम न हो के किस की है तो डोर किसी भिस्कीन को दे दे के वोह किसी जाईज काम में सर्फ़ (या'नी कोई जाईज इस्ति'माल) कर ले, और भुद भिस्कीन हो तो अपने सर्फ़ (या'नी इस्ति'माल) में लाये, फिर जब मा'लूम हो के कुलां मुस्लिम की है और वोह इस तसद्दुक या इस भिस्कीन के अपने सर्फ़ पर राजी न हो तो देनी आयेगी और कन्कय्या (या'नी पतंग) का मुआ-वजा भहर डाल कुदु नही. (आ'ला हजरत رَحْمَةُ اللّٰهِ تَعَالٰی عَلَیْہِ मज़ीद लिफते हैं :) कन्कय्या (या'नी पतंग) उड़ाना मन्अ है और लडाना गुनाह. (इतावा र-जविया, जि. 24, स. 660) जब के इतावा र-जविया जिल्द 24 सफ़हा 659 पर आ'ला हजरत رَحْمَةُ اللّٰهِ تَعَالٰی عَلَیْہِ लिफते हैं : कन्कय्या (या'नी पतंग) उड़ाने में वक्त (और) माल का जायेअ करना

કરમાને મુસ્તફી صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस क पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुःख पाक न पढ़ा तबकीक वोह बढ भण्ट हो गया. (उर्दू)

હોતા હૈ, યેહ ભી ગુનાહ હૈ ઓર ગુનાહ કે આલાત કન્કય્યા (યા'ની પતંગ), ડોર બેચના ભી મન્અ હૈ. (ઐઝન, સ. 659)

**સુવાલ :** આજ કલ પતંગ કી ડોર લૂટને કા ઉર્ફ જારી હૈ, લિહાઝા ક્યા અબ લૂટને કી ઈજાઝત નહીં સમઝી જાએગી ?

**જવાબ :** ઈજાઝત નહીં સમઝી જાએગી, હર ઉર્ફ જાઈઝ નહીં હુવા કરતા. માલિક ખામોશ ઈસ લિયે હો જાતા હૈ કે પતંગ યા ડોર લૂટને કા આમ રવાજ હો ચલા મગર ઈસ તરહ અપના માલ જાને પર દિલ સે રાઝી કૌન હો સકતા હૈ ! ઈસ કા બસ ચલે તો વોહ ખુદ હી દૌડ કર અપની કટી પતંગ પકડ લે, કિસી કો ભી અપની પતંગ ન લૂટને દે, કભી કભાર અપની કટી હુઈ પતંગ કરીબ ગિરને પર ખુદ લૂટને કી કોશિશ ભી કી જાતી હૈ. નીઝ પતંગ કટ જાને કે બા'દ અપની ડોર જલ્દી જલ્દી ખીંચતે ઈસી લિયે હેં કે લૂટને વાલોં કે હાથ ન આએ યા લુટ્ટેરે કે હાથ સે જિતની બચાઈ જા સકતી હૈ બચા લી જાએ. ઈસ કો યૂં સમઝ લેં કે અગર કોઈ ડાકૂ કિસી કો લૂટ રહા હો ઓર લુટને વાલા અન્દર કી જેબોં કો છુપા કર યા કિસી દૂસરે તરીકે સે બચાને કી કોશિશ કર રહા હો તો ઈસ કા યેહ મતલબ નહીં કે બકિય્યા રકમ કે લુટને પર વોહ રાઝી હૈ.

### પતંગ બાઝી કે દુન્યવી વ માલી નુકસાનાત

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આ'લા હઝરત رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ

કે ફતવે મેં જો પતંગ ફાડ દેને કા ઝિક હૈ યેહ વહાં કે લિયે હૈ જહાં લડાઈ ઝગડે કા અન્દેશા ન હો, અગર ફસાદ યા બુગ્ગો ઈનાદ પૈદા હોને કી સૂરત હો તો ફિતને સે બચને કી સૂરત ઈખ્તિયાર કરે. બહર હાલ પતંગ બાઝી કરને વાલોં કી ખિદમતોં મેં મ-દની ઈસ્તિજા હૈ કે ઈસ સે તૌબા કર કે અપને રબ رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ કો રાઝી કર લેં.

करमाने मुस्तका علی اللہ تعالیٰ غفور و رحیم : जिस ने मुझ पर इस मरतबा सुबह और इस मरतबा शाम दुइद्वे पाक पढा  
(उसे क्रियामत के दिन मेरी शक्रातत मिलेगी. (क्रियामत))

पतंग बाज़ी में उभरवी नुकसान तो है ही, इस में दृन्यवी तौर पर भी हलाकत का सामान है. कर्ष पतंग बाज़ धाती (या'नी मेटल की) डोर इस्ति'माल करते हैं, धाती डोर वाली पतंग कट कर बसा अवकात बर्की तारों से जा टकराती है और फिर इस से बिजली के ट्रान्सफॉर्मर्ज और दीगर आलात की तबाही भय जाती है और अेक ही दिन में करोडों रुपियों का नुकसान हो जाता है, कर्ष कर्ष घन्टों के लिये अलाके तारीकी में डूब जाते हैं, अस्पतालों में बिजली न होने की वजह से नाजुक ओपरेशनों में रुकावटें भडी होती हैं, मोटरें न चलने की वजह से पानी की डिल्लत (या'नी तंगी) हो जाती है, बिजली की बार बार ट्रिपिंग (या'नी आने जाने) से घरेलू इलेक्ट्रोनिक अश्या और कारभानों वगैरा की सन्धतों को पडोचने वाले नुकसानात का हत्मी अन्दाज़ा लगाना तो मुश्किल है अलबत्ता अेक सर्वे के मुताबिक 2003 ई. में पतंग की धाती डोर की वजह से सिर्ई मर्कजुल औलिया लाहोर में बिजली इराहम करने वाले इंदारे लेस्को (Lesco) को अढाई अरब रुपै का नुकसान उठाना पडा था !

### पतंग बाज़ी से होने वाले ज़ानी नुकसानात

पतंग बाज़ी से माली नुकसानात के साथ साथ ज़ानी नुकसानात भी होते हैं, धाती डोर अगर बिजली की तार से छू जाये तो पतंग उडाने वाला या फिर उस को लूटने वाला बसा अवकात भौत के मुंड में यला जाता है. इस ज़िम्न में मा'भूली तब्दीली के साथ बा'ज लरजा भैज अफ्बारी भबरें मुला-हजा हों : 2004 ई. में मर्कजुल औलिया लाहोर के “अब्दुल करीम” रोज पर अपने घर की छत पर

ફરમાને મુસ્તફા : صلى الله تعالى عليه و آله وسلم : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुरुद शरीफ न पढा उस ने जफा की. (عبدالرزاق)

ખડે એક સેલ્ક મેન ને એક કટી પતંગ પકડને કે લિયે પતંગ કી ધાતી તાર કા સિરા થામા હી થા કે દૂસરે સિરે પર બંધી પતંગ હાઈ વોલ્ટેજ તારોં પર જા ગિરી ઔર વોહ સેલ્ક મેન કરન્ટ કા શદીદ ઝટકા લગને સે ફૌત હો ગયા

❁ ઈસી તરહ લાહોર હી મેં એક બીસ સાલહ નૌ જવાન ધાતી તાર વાલી પતંગ પકડતે હુએ કરન્ટ લગને સે ઈન્તિકાલ કર ગયા ❁ તાજપૂરા સકીમ મેં ગ્યારહ સાલહ બચ્ચે કી માં અપને ઈક્લૌતે બેટે કે લિયે ઈદ કે કપડે ખરીદને ગઈ હુઈ થી ઔર ઈધર વોહ છત પર ખેલ રહા થા કે એક કટી પતંગ અપની ધાતી તાર સમેત ઉસ પર આ ગિરી ઔર વોહ કરન્ટ લગને સે દમ તોડ ગયા ❁ ધાતી ડોર કા એક ઔર શિકાર બાદામી બાગ (મર્કઝુલ ઔલિયા લાહોર) કા 30 સાલહ શપ્સ બના જો ઈદ સે એક રોઝ કબ્લ ઈતવાર કો એક કટી પતંગ કી લટક્તી હુઈ ધાતી તાર મેં ઉલઝ કર કરન્ટ લગને સે વફાત પા ગયા. (બીબીસી ઉર્દૂ ન્યૂઝ ઓન લાઈન, ફરવરી, 2004 ઈ.)

### પતંગ કી કેમીકલ વાલી ડોર કી તબાહ કારિયાં

કેમીકલ વાલી ડોર કે ઈસ્તિ'માલ સે ન સિર્ફ પતંગ બાઝ કી ઉગ્લિયાં ઝખ્મી હોતી રહતી હૈં બલ્કે પતંગ કટને કે બા'દ ચેહી ડોર જબ કિસી મોટર સાઈકલ સુવાર યા મોટર સાઈકલ કી ટંકી પર બૈઠે હુએ બચ્ચે કે ગલે પર ફિર જાએ તો તેઝ ઘુરી કી તરહ પલક ઝપક્તે મેં ઉસે ઝબ્હ કર ડાલતી હૈં. મુખ્તલિફ અખ્બારાત સે લિયે ગએ ઐસે હી 9 ઈબ્રત નાક વાકિઆત મા'મૂલી સી તબ્દીલી કે સાથ મુલા-હઝા કીજિયે :

❁ લાહોર : 14 સાલહ તાલિબે ઈલ્મ નદીમ હુસૈન શામ કો ટ્યૂશન પઠ કર મોટર સાઈકલ પર ઘર વાપસ આ રહા થા, ગરદન પર કટી પતંગ કી ડોર ફિર જાને સે ઉસ કી શહરગ કટ ગઈ, ઈસ સે પહલે



करमाने मुस्तफ़ी صلى الله تعالى عليهم و آله و سلم : जो मुज पर रोज जुमुआ दुइद शरीफ़ पढेगा में डियामत के दिन उस की शफ़ाअत करेगा. (अब्रहाम)

के कोई मद्द को आता वोड “कलिमा यौक” के करीब दम तोड युका था. लाश जब घर पडोयी तो कोडराम मय गया. वोड मेट्रिक के ईम्तिहान की तय्यारी कर रहा था, उस की बहनं जिन्डों ने उस के ताबनाक मुस्तफ़िबल के डवाले से कई ज्वाब देष रभे थे, उस की कितार्बे डाय में लिये बे बसी से आंसू बहाती रहीं और उधेड उम्र मां लाश से लिपट कर देर तक रोती रहीं ❁ **मज्जन पूरा** (मर्कज़ुल औलिया लाडोर) का अेक रिहाईशी अपनी अडलिया और तीन सालड बेटे इंडीम के साथ मोटर साईकिल पर सुवार डो कर सुसराल जा रहा था के मुजंग के करीब इंडीम यकायक भून में लतपत डो गया ! दोनों मियां बीवी वडूशत से यीभो पुकार करने लगे, जब गौर से देभा तो मा'लूम डुवा के डोर बय्ये की शहरग काट युकी है, यन्द लम्हों के अन्दर अन्दर नन्हे मुन्ने इंडीम ने बाप की गोड में तडप तडप कर जान दे दी. (नवाअे वक्त) ❁ **शाडभाग** का अेक नौ जवान अली मोटर साईकिल पर जा रहा था के उस के गले में पतंग की धाती तार डिर गई. (जंग) ❁ **डीरोज पूर रोड** पर अेक मोटर साईकिल सुवार सिकन्दर ईकराम की गरदन डोर की जड में आ कर कट गई. (नवाअे वक्त) ❁ (मर्कज़ुल औलिया) **लाडोर** के अलाके शाडभाग का नौ जवान मुहम्मद अली मोटर साईकिल पर जा रहा था यकायक अेक कटी पतंग की शीशे का मांजा लगी डोर उस की गरदन को काट गई और वोड सडक के कनारे तडप तडप कर दम तोड गया ❁ 14 अगस्त 2006 ई. में सोमवार की सड पहर तीन सालड षटीजा यूसुफ़ अपने वालिद मुहम्मद यूसुफ़ के साथ मोटर साईकिल पर अल्लामा ईकबाल रोड से गुजर रही थी के पतंग की डोर उस के गले पर डिरने से उस के गले की रग कट गई और भून बडने लगा, बय्यी के वालिद उसे शालामार

ફરમાને મુસ્તફા ﷺ : صلى الله تعالى عليه و آله وسلم : मुझ पर दुइडे पाक की कसरत करो बेशक येह तुम्हारे लिये तहारत है. (अबुयूसुफ)

અસ્પતાલ લે ગએ જહાં ડોક્ટરોં ને ઉસ કે ઇન્તિકાલ કી તસ્દીક કર દી. બચ્ચી ઇસ્લામિચ્યા પાર્ક કી રહને વાલી થી. (બીબીસી ઉર્દૂ 14 અગસ્ત 2006 ઇ.) ❁ (મર્કઝુલ ઔલિયા) લાહોર : અન્દરૂને શહર કા રિહાઈશી શખ્સ અપને ડેઢ સાલહ બચ્ચે અબ્દુરહમાન કો અપની મોટર સાઈકલ પર બિઠા કર લે જા રહા થા કે અચાનક ડોર ઉસ કે બચ્ચે કી ગરદન પર ગિરી, બચ્ચે કે વાલિદ કા કહના હૈ : મુઝે અચાનક બચ્ચે કે રોને કી આવાઝ આઈ ઔર વોહ મેરી ગોદ મેં તડપને લગા, ઉસ કી ગરદન ખૂન સે ભર ગઈ. મેં ઉસે અસ્પતાલ લે ગયા લેકિન વોહ જાં બર ન હો સકા. (બીબીસી ઉર્દૂ 5 જૂન 2006 ઇ.) ❁ 2006 ઇ. મેં ઇતવાર કે દિન (મર્કઝુલ ઔલિયા) લાહોર મેં ફીરોઝ પૂર રોડ ઇછરા કી સડક પર કટી હુઈ પતંગ કી ડોર દસ સાલહ બચ્ચી અક્સા કે ગલે પર ફિર ગઈ જો અપને વાલિદ કે સાથ મોટર સાઈકલ પર આગે બૈઠી હુઈ થી. અક્સા કે વાલિદ ને ખૂન મેં લતપત બચ્ચી કો અસ્પતાલ પહોંચાયા લેકિન વોહ બચ ન સકી ક્યૂંકે ડોક્ટરોં કે મુતાબિક ઉસ કી શહરગ ગહરાઈ સે કટ ગઈ થી ઔર બહુત ખૂન બહ ચુકા થા, વોહ અપને માં બાપ કી ઇક્લૌતી બેટી થી. (બીબીસી ઉર્દૂ) ❁ જનવરી 2013 ઇ. મેં કરાચી કે વસ્તી અલાકે નાઝિમઆબાદ મેં 7 સાલ કી બચ્ચી વાલિદ કે સાથ મોટર સાઈકલ પર ગુઝર રહી થી કે પતંગ કી ડોર ઉસ કે ગલે પર ફિર ગઈ જિસ કે નતીજે મેં બચ્ચી શદીદ ઝખ્મી હો ગઈ. બચ્ચી કો તશવીશ નાક હાલત મેં અસ્પતાલ મુન્તકિલ કિયા ગયા લેકિન ખૂન ઝિયાદા બહ જાને કે બાઈસ વોહ જાં બર ન હો સકી. (જંગ ઓન લાઈન 25 જનવરી 2013 ઇ.)

## પતંગ લૂટને કે દૌરાન હોને વાલી હલાકતેં

ઈસી તરહ ચન્દ રુપૈ કી પતંગ લૂટને કે લિયે લડકે બાલે હાથોં

ફરમાને મુસ્તફા صَلَّی اللہُ تَعَالَى عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّم : તુમ જહાં ભી હો મુઝ પર દુરૂદ પઢો કે તુમ્હારા દુરૂદ મુઝ તક પહોંચતા હૈ. (طبرانی)

મેં લખ્ખી લખ્ખી છડિયાં ઔર બાંસ લિયે સડકોં પર દીવાના વાર ફિર રહે હોતે હૈં, જૂંહી કોઈ કટી પતંગ દિખાઈ દેતી હૈં ઉન પર એક જુનૂન સા તારી હો જાતા હૈં તેઝ રફતાર ટ્રાફિક કી પરવાહ કિયે બિગૈર પતંગ કે પીછે લપકતે હૈં, કઈ બચ્ચે ઔર નૌ જવાન ઈસ દૌરાન ગારિયોં સે ટકરા કર શદીદ ઝખ્ખી હો જાતે હૈં બા'ઝ અવકાત તો કુચલ કર ફૌત ભી હો જાતે હૈં. બા'ઝ લોગ છતોં પર પતંગ લૂટને કી કોશિશ મેં કઈ કઈ મન્જિલા ઈમારતોં સે ઝમીન પર જા ગિરતે ઔર અપને હાથ પાઉં તુડવા લેતે હૈં ઔર કઈ મૌત કે મુંહ મેં ચલે જાતે હૈં. જૈસા કે અખ્બારી રિપોર્ટ કે મુતાબિક ❁ 27 જનવરી 2004 ઈ. કો શાદી મેં શિક્ટ કે લિયે અપને વાલિદ કે સાથ રાવલ પિન્ડી સે લાહોર આને વાલા આઠ સાલહ બચ્ચા આહની રાડ કે ઝરીએ બિજલી કી તારોં સે લિપટી પતંગ ઉતારતે હુએ કરન્ટ લગને સે ફૌત હો ગયા ❁ 2006 ઈ. મેં ચૌહંગ કે રિહાઈશી મેહનત કશ કા 7 સાલહ બેટા જો દૂસરી જમાઅત કા તાલિબે ઈલ્મ થા પતંગ કી તરફ લપકા ઔર છત સે ગિર ગયા ઔર બુરી તરહ ઝખ્ખી હો ગયા ઔર અસ્પતાલ મેં દમ તોડ ગયા. જબ લાશ ઘર પહોંચી તો માં પર ગશી તારી હો ગઈ ❁ નૌ શહરા રોડ પર 15 સાલહ નૌ જવાન પતંગ બાઝી કરતે હુએ મકાન કી છત સે ગિરા ઔર મૌકઅ પર હી ફૌત હો ગયા ❁ 22 માર્ચ 2006 કો (મર્કઝુલ ઔલિયા) લાહોર મેં એક બચ્ચા પતંગ લૂટતે હુએ ટ્રેન કે નીચે આ કર ઈન્તિકાલ કર ગયા. (બીબીસી ઉર્દૂ ઓન લાઈન બિ તગચ્ચુરે કલીલ)

### એક દિલ હિલા દેને વાલા વાકિઆ

જેહ્લમ (પંજાબ, પાકિસ્તાન) મેં વાકેઅ એક ઘર કી છત સે બિજલી કે તાર બ મુશ્કિલ દો યા ત્રીન ફુટ કે ફાસિલે પર હોંગે, ઉન

करमाने मुस्तफ़ा صلى الله تعالى عليه و آله وسلم : जिस ने मुझ पर दस मरतबा दुरुद पाक पढा अल्लाह उस पर सो  
रहमतें नाज़िल करमाता है. (प्र. ५)

तारों में अेक पतंग अटकी हुई थी, दो<sup>2</sup> बय्ये छत की मुंडेर पर बडे़ डो कर उस पतंग के हुसूल की कोशिश कर रहे थे मगर उन का हाथ छोटा था और फ़ासिला ज़ियादा, दोनों ने मशवरा किया और छोटे बय्ये ने बडे़ की टांगें मजबूती से पकड लीं और बडा कुछ आगे डो कर मुंडेर पर लटक गया जूँडी उस ने पतंग लेने के लिये हाथ बढाया, उस का हाथ बिजली की नंगी तार पर जा पडा, रोशनी का अेक जमाका हुवा फिर गोशत जलने की बू आने लगी, छोटा बय्या अेक जटके से गिरा, उडा और तेजी से नीचे भागा, जितनी देर में घर वाले उपर पडोंचे, तारों में जूलता बय्या जल कर कबाब डो युका था.

### 6 बरस में पतंग बाज़ी से 825 अम्वात

अेक सर्वे के मुताबिक 2000 ई. से 2006 ई. तक सिर्फ़ ९<sup>०</sup> साल के अर्से में 825 अफ़राद ईस पतंग बाज़ी की वजह से झैत, सेंकडों ज़म्मी और कई अफ़राद उम्र भर के लिये मा'जूर डो गअे. 17 मार्च 2008 ई. में अेक अफ़्बार में येड अफ़सोस नाक फ़बर शाअेअ हुई के कामोन्की में पतंग बाज़ी करते हुअे 9 बय्ये छत से गिरे और शहीद ज़म्मी हुअे जिन को अस्पताल में दाखिल करा दिया गया. ईस तरह के कई वाकिआत की वजह से यन्द साल से बसन्त मेले और पतंग बाज़ी पर कानूनी तौर पर पाबन्दी लगा दी गई है जो ता दमे तहरीर बर करार है.

### 2013 ई. में पाबन्दी के बा वुजूद

### मुफ़्तलिफ़ शहरों में डोने वाली अम्वात

2013 ई. में कानूनन पाबन्दी के बा वुजूद बा'ज शहरों में बसन्त मनाई गई, अफ़्बारात के मुताबिक हुकूमती पाबन्धियों के बा वुजूद

કરમાને મુસ્તફા ﷺ : جس کے پاس میرا ٹیک ڈો اور વોહ મુઝ પર દુરૂદ શરીફ ન પઢે તો વોહ લોગોં મેં સે કન્જૂસ તરીન શખ્સ હૈ. (ઝિયાત)

મુખ્તલિફ અલાકોં મેં પતંગ બાઝી કે દૌરાન છત સે ગિરને, ધાતી ડોર ફિરને ઓર હવાઈ ફાયરિંગ સે ૩ બચ્ચે ફૌત ઓર એક લડકી સમેત ૪૪ અફરાદ શદીદ ઝખ્મી હો ગએ. રાવલ પિન્ડી શહર મેં જુમુઆ કે રોઝ બસન્ત કે મૌકઅ પર પતંગ કી કેમીકલ લગી ડોર, હવાઈ ફાયરિંગ, ધેંગા મુશ્તી (યા'ની હુલ્લડ બાઝી) ઓર છત સે ગિર કર ૩ બચ્ચે ફૌત ઓર તકરીબન ૪૦ અફરાદ શદીદ ઝખ્મી હો ગએ ❁ એક બચ્ચી સર મેં ગોલી લગને સે ઝિન્દગી વ મૌત કી કશ-મકશ મેં મુખ્તલા જબ કે ❁ ધાતી ડોર કે કરન્ટ સે એક બચ્ચા કોમે મેં ચલા ગયા ❁ કઈ ઘરોં મેં સફે માતમ બિછ ગઈ. યેહ સિલ્સિલા સારા દિન ઓર સારી રાત જારી રહા, પૂરા શહર હવાઈ ફાયરિંગ સે ગૂંજતા રહા ❁ (મર્કઝુલ ઓલિયા) લાહોર મેં શાદબાગ કે અલાકે મેં ૧૮ સાલહ નૌ જવાન પતંગ બાઝી કરતે હુએ છત સે નીચે ગિર કર શદીદ ઝખ્મી હો ગયા ❁ એક નૌ જવાન છત પર પતંગ બાઝી કર રહા થા ઈસ દૌરાન પાઉ ફિસલ જાને કે બાઈસ વોહ નીચે ગિર કર શદીદ ઝખ્મી હો ગયા. ઊસ કી હાલત તશ્વીશ નાક બતાઈ જાતી હૈ ❁ કામોન્કી મેં ધાતી ડોર ફિરને સે કમસિન બચ્ચે સમેત ત્રીન અફરાદ શદીદ ઝખ્મી હો ગએ ❁ પતંગ બાઝી કે નતીજે મેં “ગલ્લા મન્ડી” કા સાત સાલહ બચ્ચા, રસૂલ નગર કા નૌ જવાન, દરવેશ પૂરા કા એક નૌ જવાન ઓર પુરાની આબાદી કા એક નૌ જવાન શદીદ ઝખ્મી હો ગએ ❁ પતંગ બાઝી કે દૌરાન “રાવલ પિન્ડી” મેં હવાઈ ફાયરિંગ સે ૧૨ સાલહ લડકી શદીદ ઝખ્મી હો ગઈ ❁ ઉધર “ગોજરાંવાલા” મેં પાબન્ડી કે બા વુજૂદ ધાતી ડોર ગલે મેં ઓર મુંહ પર ફિરને કે બાઈસ કમસિન બચ્ચે સમેત દો<sup>૨</sup> અફરાદ શદીદ ઝખ્મી હો ગએ ❁ સેટેલાઈટ

करमाने मुस्तफی : على الله تعالى عليه و آله وسلم : उस शप्स की नाक पाक आलूद हो जिस के पास मेरा ठिक हो और वोह मुज पर दुइडे पाक न पडे. (एम)

टाउन का अहील अपने तीन सालह बेटे के हमराह मोटर साईकिल पर जा रहा था नौ शहरा रोड के करीब कमसिन बय्ये के गले में अथानक पतंग की धाती डोर फिर गई जिस के नतीजे में शहीद जम्मी हो गया ❁ ठलावा अजीं शाहीनआबाद में मोटर साईकिल पर जाने वाले अब्दुल्लतीफ़ के येडरे पर पतंग की डोर फिर गई जिसे मकामी अस्पताल में ले जाया गया ❁ कानूनी पाबन्दी के बा वुजूद गुजश्ता रोज शहरियों ने मुप्तलिफ़ अलाकों में पतंग बाजी कर के कानूनी पाबन्धियों को हवा में उडा दिया ❁ रावल पिन्डी पोलीस ने पतंग बाजों के भिलाफ़ केक डाउन के दौरान 30 से जाईद अफ़राद को गिरिफ़्तार कर के पतंगें और डोरें भरआमद कर लीं जिन में केमीकल वाली डोर भी शामिल है.

(नवाअे वक्त ऑन लाईन 9 मार्च 2013 ई. बित्सर्दुफ़)

### हवाई फ़ायरिंग से हलाकतें

बसन्त में वकई वकई से हवाई फ़ायरिंग का भी सिक्सिला रहता है जिस से दिल के मरीज, छोटे बय्ये और धरेलू भवातीन सहम जाती हैं. बन्दूक से निकली दुई गोली बा'ज अवकात किसी को जा लगती है जिस से वोह जम्मी हो जाता है या फिर जान से जाता है, युनान्ये अेक अम्बारी इत्तिलाअ के मुताबिक (मर्कुल औलिया) लाडोर में इरवरी 2007 ई. में बसन्त के मौकअ पर तीन बय्ये गोली लगने से फ़ौत हो गअे. (बीबीसी उर्दू ऑन लाईन 25 इरवरी 2007 ई.)

### बसन्त मेले की गुहूसतें

ईस्लाम और मुसल्मानों की महब्बत का हम तरने वाले भीठे भीठे ईस्लामी भाईयो ! अह्लाह तआला आप पर रहम इरमाअे !

ફરમાને મુસ્તફા ﷺ: عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: जिस ने मुझ पर रोजे जुमुआ दो सो बार दुइडे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ छोड़े. (क़ुरआन)

યકીનન યેહ વાકિઆત નિહાયત અફસોસ નાક હૈં, બસન્ત કે મેલે કે બાઈસ કઈ ઘરોં મેં સફે માતમ બિઇ જાતી હૈ, અસ્પતાલ ઝખ્મિયોં સે ભર જાતે હૈં, દેખતે હી દેખતે મોટર સાઈકિલ સુવારોં કે ગલે કટ જાતે હૈં, કિતને હી બચ્ચે ઔર નૌ જવાન બિજલી કી તારોં ઔર ખમ્બોં સે લટક કર લુક્મએ અજલ બન જાતે હૈં, ઘરોં કી છતોં સે ગિર કર મા'જૂર હો જાને વાલોં કા તો કોઈ શુમાર હી નહીં, સદ કરોડ અફસોસ ! ઇજતિમાઈ તૌર પર રબ્બે ગફફાર عَزَّ وَجَلَّ કી ના ફરમાનિયાં કર કે અપને આપ કો અઝાબે નાર કા હકદાર બનાયા જાતા હૈ, આપસ મેં લડાઈ ઝગડે હોતે હૈં, પડોસિયોં કો તંગ કિયા જાતા હૈ, નમાઝેં ઝએઝ કી જાતી હૈં, માલ ફુઝૂલ ઉડાયા જાતા હૈ, અપના અનમોલ વક્ત ગુનાહોં મેં ગુઝારા જાતા હૈ, બસન્ત ઈસ તરહ કી બહુત સારી નુહૂસતેં લુટાતી હૈ. ક્યા કોઈ હકીકી આશિકે રસૂલ “બસન્ત” કી તાઈદ કર સકતા હૈ ? નહીં નહીં ઔર હરગિઝ નહીં. તાશે બાજે બજાના, પતંગ બાઝી કરના વગૈરા લહ્વો લઈબ મેં દાખિલ હૈ ઔર કુરઆને કરીમ મેં ઈસ કી મુમા-ન-અત કી ગઈ હૈ યુનાન્ચે પારહ 21 સૂરએ લુક્માન આયત નમ્બર 6 મેં ઈશદિ રબ્બુલ ઈબાદ હૈ :

وَمِنَ النَّاسِ مَن يَشْتَرِي لَهْوَ

الْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ

اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَ هَاهُؤُورِ

أُولَئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ ﴿٦﴾

तर-ज-मअे कन्जुल ईमान : और कुछ लोग भेल की बात भरीदते हें के अल्लाह की राह से बहका दें बे समझे और उसे हंसी बना लें उन के लिये जिल्लत का अजाब है.

સદરુલ અફાઝિલ હઝરતે અલ્લામા મૌલાના સચ્ચિદ મુહમ્મદ નઈમુદ્દીન મુરાદઆબાદી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْهَادِي ઈસ આયત કે તહ્ત લિખતે હૈં :

इरमाने मुस्तफ़ा عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : मुझ पर दुःख शरीफ़ पढो अल्लाह ख़ुश तुम पर रहमत भेजेगा.

(अबुसली)

लड्डूव या'नी भेल छर उस बातिल को कडते हैं जो आदमी को नेकी से और काम की बातों से गड़लत में डाले. (अज़ाधनुव इरफ़ान) मुफ़स्सिरे शहीर हकीमुव उम्मत हज़रते मुफ़ती अहमद यार ખાન عَلَيْهِ رَحْمَةُ الْخَنَّانِ ईस आयत के तह्त इरमाते हैं : मा'लूम हुवा के बाजे, ताश, शराब बलके तमाम भेलकूद के आलात भेयना भी मन्अ हैं और खरीदना भी ना ज़ाईज क्युंके येह आयत उन खरीदारों की बुराई में उतरी. ईसी तरह ना ज़ाईज नाविल, गन्दे रिसाले, सिनेमा के टिकट, तमाशे वगैरा के अस्बाब सब की खरीदो इरोफ़्त मन्अ है के येह तमाम "هُوَ الْحَدِيثُ" (या'नी भेल की बात) हैं. (नूरुव इरफ़ान)

### मूसीकी की कानफ़ाड आवाज़

बसन्त मेले में रात ही से कानफ़ाड आवाज़ में ज़दीद तरीन साउन्ड सिस्टम के ज़रीअे बडे बडे स्पीकरों पर बे हंगम मूसीकी बजाई जाती और बेहूदा बसन्ती गानों से महल्ले और बाज़ार गूंजने लगते हैं बिल फ़ुसूस नन्हे नन्हे बन्ध्यों, उम्र रसीदा बुजुर्गों, बिस्तर पर सिसक्ते भरीजों की रात की नींद और दिन का सुकून बरबाद किया जाता है. मूसीकी सुनना सुनाना हराम और जहन्नम में ले जाने वाला काम है युनान्धे हज़रते सय्यिहुना अल्लामा इब्ने आबिदीन शाभी قُدَسَ سِرُّهُ السَّمَاوِي लिखते हैं : (लयके तोडे के साथ) नायना, मज़ाक उडाना, ताली बजाना, (नीज आलाते मूसीकी जैसा के) सितार के तार बजाना, बरबत, सारंगी, रबाब, बांसरी, कानून, ज़ांज़न, बिगल बजाना मक़रूहे तहरीमी (या'नी करीब ब हराम) है क्युंके येह सब कुफ़्फ़ार के शिआर (या'नी तौर तरीके) हैं,



﴿فَرْمَانَهُ مُسْتَكْفًا صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ﴾ : مُسْتَكْفًا پَر كَسْرَت سَ دُرُودِ پَاك پَدُو بَشَاك تُمْبَارَا مُسْتَكْفًا پَر دُرُودِ پَاك پَدُونَا  
تُمْبَارَا غُونَا لُو كَا لِي يَ مَكْتَبِرَت هَ . (مَسْمُومٌ)

باंसری اور دیگر ساجوں کا سُننا بِي اُرام هَ अगर अयानक सुन  
लिया तो मा'जूर है . (رَدُّ الْفِتْرَةِ ج ٩ ص ٦٠١) अयान कर्दा कैफ़ियत में मरीजों  
वगैरा की ईजा रसानी का बِي सामान है और अगर मा'लूम होने के  
बा वुजूद मूसीकी से किसी को ईजा पलोंयाई तो येह बِي गुनाह व  
अराम और जहन्नम में ले जाने वाला काम है . मेरे आका आ'ला  
उज्जरत رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ इतावा र-जविय्या शरीफ़ जिल्द 24 सफ़हा 342  
में त-अरानी शरीफ़ के हवाले से नकल करते हैं : सुल्ताने दो जहान  
صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का इरमाने ईअत निशान है :  
- (بِلَا يَا'نِي) जिस ने (बिला  
वजहे शर-ई) किसी मुसल्मान को ईजा दी उस ने मुजे ईजा दी और जिस ने मुजे  
ईजा दी उस ने अद्लाह उज्जुल को ईजा दी . (مُعْجَم أَوْسَطِ ج ٢ ص ٣٨٧ حديث ٣٦٠٧)  
अद्लाह व रसूल صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ को ईजा देने वालों के बारे  
में पारह 22 सू-रतुल अहज़ाब आयत 57 में ईशाह होता है :

إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَ  
رَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا  
وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا  
مُّهِينًا ﴿٥٢﴾

तर-ज-मअे क-जुल ईमान : बेशक जो  
ईजा देते हैं अद्लाह और उस के रसूल  
को उन पर अद्लाह की ला'नत है  
दुन्या व आभिरत में और अद्लाह  
ने उन के लिये जिल्लत का अजाब  
तय्यार कर रखा है .

### मस्जिद के करीब ट्रेलर पर धमा चोकडियां

जसन्त के मौकअ पर मर्कजुल औलिया (लाहोर) में अेक साल  
अेक तिज्जरती कम्पनी ने शहर में ज़ा ज़ा "ट्रेलर" अडे कर दिये जिन

કરમાને મુસ્તફા ﷺ : જો મુઝ પર એક દુરુદ શરીફ પઢતા હે અલ્લાહ ઁજલ ઁસ કે લિયે એક કીરાત અજ લિખતા હે ઁર કીરાત ઉલુદ પહાડ જિતના હે. (મુવાઝઁ)

પર લડકે ઁર લડકિયાં ગાનોં કી ધુનોં પર બેહૂદા કિસ્મ કા ઁન્સ કરતે થે. મોડલ ટાઉન મેં ભી ઈસી કમ્પની કા ટ્રક (TRUCK) મસ્જિદ સે તકરીબન 20 ફુટ કે ફાસિલે પર ખડા કર દિયા ગયા. અઝાન ઁર નમાઝ કે અવકાત મેં ભી યેહ લોગ નાય ગાને મેં બદ મસ્ત રહે. સ્પીકરોં કી કાનફાડ આવાઝોં, શર્મનાક ગાનોં, બે ઢંગે નાય નખરોં ઁર ઊધમ બાઝિયોં સે બેઝાર હો કર મકામી લોગોં ને મુશ્તઈલ હો કર ઁસ ટ્રેલર પર હલ્લા બોલ દિયા ઁર નાય ગાને કા સિલ્સિલા ઝબર દસ્તી બન્દ કરવાયા.

### હલાકત કે અસ્બાબ

મુસલ્માનોં કી હાલતે ઝાર પર અફસોસ કા ઈઝહાર કરતે હુએ, દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ 246 સફહાત પર મુશ્તમિલ કિતાબ, “ઈસ્લામી ઝિન્દગી” સફહા 137 પર મુફસ્સિરે શહીર હકીમુલ ઉમ્મત હઝરતે મુફતી અહમદ યાર ખાન ખાન ફરમાતે હેં : સિનેમા મુસલ્માનોં સે આબાદ, ખેલ તમાશોં મેં મુસલ્માન આગે આગે, તીતર બાઝી, બટેર બાઝી ઁર પતંગ બાઝી, મુર્ગ બાઝી ગરઝ સારી બાઝિયાં ઁર હલાકત કે સારે અસ્બાબ મુસ્લિમ કોમ મેં જમ્મ હેં. (ઈસ્લામી ઝિન્દગી, સ. 137)

### લડકિયાં લડકે મિલ કર નાયતે હેં

બા'ઝ બડે બડે હોટલોં, કોઠિયોં, બંગલોં, ઘરોં, દફતરોં કી છતોં ઁર પાર્કોં મેં બસન્ત મેલા મનાને વાલી બે પર્દા ઁરતોં ઁર મર્દોં કી મખ્લૂત મહફિલેં સજાઈ જાતી હેં, તરહ તરહ કી તરાશ ખરાશ વાલે ઁર નીમ ઉર્યા લિબાસ ઝેબે તન કિયે જાતે હેં જિન સે બદ નિગાહી કા બાઝાર ખૂબ ગર્મ હોતા ઁર ઈશ્ક વ ફિસ્ક કા તૂફાન ખડા હો જાતા હે, શરાબ કે જામ પર જામ લુંઢાએ જાતે હેં, મૂસીકી કી ધુનોં પર જવાન લડકે ઁર

ફરમાને મુસ્તફા ﷺ : جَسَى اللّٰهُ تَعَالَى عَلَيَّ وَ اَلِهٖ وَسَلَّمَ : जिस ने किताब में मुझ पर दुइदह पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये ईस्तिफ्कार करते रहेंगे. (अ. 1)

લડકિયાં નિહાયત બે હયાઈ કે સાથ નાયતે ગાતે હૈં.

## કાલે સાંપોં કે ઝહર કા ઘૂંટ

ઐ અલ્લાહ વ રસૂલ ﷺ કે માનને વાલે ઈસ્લામી ભાઈયો ઔર ઈસ્લામી બહનો ! શરીઅત મેં શરાબ પીના પિલાના ભી હરામ ઔર નાયના ગાના ભી હરામ હૈં ઔર યેહ સબ જહન્નમ મેં લે જાને વાલે કામ હૈં. સુનો ! સુનો ! ફરમાને મુસ્તફા ﷺ હૈ : جَسَى اللّٰهُ تَعَالَى عَلَيَّ وَ اَلِهٖ وَسَلَّمَ હૈ : जिस ने दुन्या में शराब पी अल्लाह पूछे उसे काले सांपों के झहर का ऐसा घूंट पिलायेगा के जिसे पीने से पहले ही उस के येहरे का गोश्त भरतन में गिर जायेगा, और जब वोह उसे पियेगा तो उस का गोश्त और ખાલ ઝડ જાએગી जिस से દોઝખિયોં કો ભી અજિયત પહોંચેગી, યાદ રખો ! બેશક શરાબ પીને વાલા, બનાને ઔર બનવાને વાલા, ઉઠાને ઔર ઉઠવાને વાલા ઔર ઈસ કી કમાઈ ખાને વાલા, સબ ગુનાહ મેં શરીક હૈં, અલ્લાહ જુઝુઝુ ન તો ઈન મેં સે કિસી કી કોઈ નમાઝ કબૂલ ફરમાએગા, ન રોઝા ઔર ન હી હજ યહાં તક કે વોહ તૌબા કર લેં, અગર બિગૈર તૌબા કિયે મર ગએ તો અલ્લાહ જુઝુઝુ પર હક હૈ કે ઉન્હેં દુન્યા મેં પિયે હુએ હર ઘૂંટ કે બદલે જહન્નમ કી પીપ પિલાએ. જાન લો ! હર નશા આવર ચીઝ હરામ હૈ ઔર હર શરાબ હરામ હૈ. (જહન્નમ મેં લે જાને વાલે આ'માલ, જિ. 2, સ. 582, 111/12/13/14)

## કફન ચોર ને જબ કબ્ર ખોદી તો.....

દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મત્બૂઆ 853 સફહાત પર મુશ્તમિલ કિતાબ, “જહન્નમ મેં લે જાને વાલે આ'માલ” જિલ્દ 2 સફહા 586 પર એક “કફન ચોર” કી તવીલ હિકાયત કા કુછ હિસ્સા અપને અન્દાઝ મેં પેશ કરતા હૂં, યુનાન્યે એક તૌબા કરને વાલે કફન ચોર કા બયાન હૈ : મેં ને કફન ચુરાને કે

करमाने मुस्तफ़ा : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज़ पर अक़ बार दुइडे पाक पढा अद्लाह उंस पर दस रइमतें भेजता है. (स्ल.)

लिये जब अक़ कब्र षोटी तो अक़ हिल खिला देने वाला मन्जर भेरे सामने था ! क्या देखता हूं के मरने वाला भिन्जीर या'नी सुवर बन युका है और उसे तौक और बेडियों से जकड दिया गया है ! मैं षौइ से थर्रा उडा..... के अक़ गैबी आवाज ने मुजे यौंका दिया ! कोई कड रडा था : “ईस के अजाब का सबभ येड है के येड शप्स शराब पीता था और तौबा किये बिगैर मर गया.” (अबुअरुव्हा, १/१४७)

कर ले तौबा रब की रहमत है बडी

कब्र में वरना सजा डोगी कडी

(वसाइले अफ़िशिश, स. 667)

### भौलता हुवा मश्रुब

हदीसे पाक में है के शराबी पुल सिरात पर आअेंगे तो जहन्नम के फिरिश्ते उन्हें उडा कर नडरुल ખબाल की तरफ़ ले जाअेंगे, पस वोड शराब के पिये हुअे डर गिलास के बढले नडरुल ખબाल से पियेंगे और वोड औसा मश्रुब है के अगर उसे आस्मान से बडा दिया जाअे तो उस की डरारत (या'नी गरभी) से तमाम आस्मान जल जाअें.

(जहन्नम में ले जाने वाले आ'माल, जि. 2, स. 582, १/१४७, १/१४८, १/१४९)

### शराब तर्क करने का घन्आम

भीठे भीठे ईस्लामी भाईयो ! अद्लाह तआला आप पर और मुज़ पर रइम करे और हमें जहन्नम के सप्त गर्भ और भौलते हुअे मश्रुब (DRINK) से बचाअे. आमीन. बराअे करम ! शराब नोशी से बय कर रलिये अगर कत्मी पीने की त्मूल कर बैठे हैं तो सख्खी तौबा कर लीजिये, जो षौइ षुदा के सबभ शराब छोडेगा उसे जन्नत में त्मर त्मर करे जां पीने को मिलेंगे, युनान्ये इरमाने मुस्तफ़ा : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

इरमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जो शप्स मुज पर दुइदे पाक पढना भूल गया वोह जन्नत का रास्ता भूल गया. (لمرأ)

अद्लाह तआला इरमाता है : “कसम है मेरी ईज़्जत की ! मेरा जो बन्दा शराब का अेक घूंट भी पियेगा, मैं उस को उतनी ही पीप पिवाउंगी और जो बन्दा मेरे भौइ से उसे छोडेगा, मैं उस को क्रियामत के दिन पाकीजा डौजों (या'नी जन्नत के डौजों) से पिवाउंगी.”

(مُسْنَدُ إِمَامِ أَحْمَدَ بْنِ حَنْبَلٍ ج ٨ ص ٣٠٧ حَدِيثُ ٢٢٣٧٠)

## मौत हांडियों में उबाले जाने से भी सप्त है

अै अद्लाह व रसूल से मडब्बत करने वाले मुसल्मानो !

आभिर कब तक अेक गुस्ताभे रसूल की याद में ज़री होने वाले गुनाहों से भरपूर बसन्त मेले के ज़रीअे आप भुदा व मुस्तफ़ा عَزَّوَجَلَّ وَصَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की नाराज़ियां भोल लेते रहेंगे ? गुनाहों के कीयड में लतपत रहते हुअे अगर मौत का शिकार हो गअे तो क्या बनेगा ! कभी आप ने नज़्अ की सप्तियों पर गौर इरमाया ? कभी इह निकलते वक्त होने वाली तकलीफ़ों के बारे में सोचा ? सुनो ! सुनो ! हज़रते अद्लामा इमाम जलालुद्दीन सुयूती शाइइँهِ رَحْمَةُ اللهِ الْقَوِي शार्फ़े ई नकल करते हैं : “मौत दुन्या व आभिरत की होल नाकियों में सब से बढ कर भौइनाक है, येह आरों से खीरने, केंयियों से काटने और हांडियों में उबालने से अाईद (तकलीफ़ देह) है, अगर मुर्दा जिन्दा हो कर मौत की सप्तियां लोगों को बता दे तो उन की नीटिं और अैशो आराम सब कुएँ अत्म हो जाता.”

(شَرْحُ الصُّدُورِ ص ٣٣)

हम यन्द मिनट की लज़्जत की आतिर कितना बडा अतरा भोल ले रहे हैं ईस बात को ईस रिवायत से समजने की कोशिश कीजिये, युनान्हे दा'वते ईस्लामी के ईशाअती ईदारे मक-त-अतुल मदीना की मत्बूआ 504 सइहात पर मुशतमिल किताब, “मिन्हाजुल आबिदीन”

﴿فَرَمَانَهُ مُسْتَقْبَلِ﴾ عَلَى اللَّهِ تَعَالَى غَلِيظٌ وَبِئْسَ مَا يَكْفُرُ بِهِ الرَّسْمُ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पढा तउकीक वोह बढ अप्त हो गया. (५१)

सईहा 141 पर हुज्जतुल ईस्लाम हजरते सय्यिदुना ईमाम अबू हामिद मुहम्मद बिन मुहम्मद बिन मुहम्मद गजाली عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي फरमाते हैं, मन्कूल है : “बेशक सकराते मौत की शिदत हुन्या की लज्जतों के मुताबिक है.” तो जिस ने जियादा लज्जतें उठाईं उसे नज्जअ की तकलीफ भी जियादा होगी. (منهاج العابدین ص १०)

### हम हुन्या में क्यूं पैदा किये गये हैं !

ऐ कुरआने करीम के हर हर हई पर ईमान रबने वाले प्यारे प्यारे ईस्लामी भाईयो ! अपनी जिन्दगी का मकसद समझने की कोशिश कीजिये, उम्रे अजीज के अनमोल हीरे पतंग बाजी और खेल तमाशों पर बरबाद मत कीजिये. जुदा की कसम ! हमें हुन्या में खेलकूद के लिये नहीं भेजा गया, सुनो ! सुनो ! अल्लाह तआला पारह 27 सू-रतुज्जारियात आयत नम्बर 56 में ईशाद फरमाता है :

﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ﴾ ५१ तर-ज-मअे कन्जुल ईमान : और मैं ने जिनन और आदमी इतने ही लिये बनाये के मेरी बन्दगी करें.

पारह 18 सू-रतुल मुअमिनून आयत 115 में ईशाद ईलाही है :

﴿أَوْصَيْتُكُمْ أَنْ تَعْبُدُوا اللَّهَ عِبَادًا مُخْلِصِينَ لَهُ دِينَكُمْ وَاللَّهُ مُخْرِجٌ تِلْكَ الْأُمَّةَ السَّاخِرَةَ﴾ ११५ तर-ज-मअे कन्जुल ईमान : तो क्या येह समझते हो के हम ने तुम्हें बेकार बनाया और तुम्हें हमारी तरफ़ फिरना नहीं.

ईस आयते मुबा-रका के तहत सदरुल अफ़जिल हजरते अल्लामा मौलाना सय्यिद मुहम्मद नईमुद्दीन मुरादआबादी عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْوَالِي अजाठनुल ईरफ़ान में फरमाते हैं : और (क्या तुम्हें) आभिरत में जजा के लिये उठना नहीं बढे तुम्हें ईबादत के लिये पैदा किया के तुम पर ईबादत

ફરમાને મુસ્તફા ﷺ : جِس نے مُؤْمِن پَر اَک بار دُڑدے پاک پढا اءءلاء اِس پَر ءس رءمءے بءءءا ہے. (س)

લાજિમ કરેં ઓર આબિરત મેં તુમ હમારી તરફ લૌટ કર આઓ તો તુમહેં તુમ્હારે આ'માલ કી જઝા (યા'ની બદલા) દેં. (ખજાઈનુલ ઈરફાન, સ. 647)

## પતંગ બાઝ કી તૌબા

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અલ્લાહ તઆલા આપ પર અપના ફઝલો કરમ ફરમાએ, નેકિયોં ઓર સુન્નતોં ભરી તવીલ ઝિન્દગી દે ઓર બે હિસાબ બખ્શે. આમીન. હાથ બાંધ કર અર્ઝ હૈ : અગર આપ ને કભી પતંગ બાઝી કી હો તો હાથોં હાથ ઈસ સે બલકે અપને સારે હી ગુનાહોં સે સચ્ચી તૌબા કર લીજિયે, બતૌરે તરગીબ એક પતંગ બાઝ કી તૌબા કી “મ-દની બહાર” મુલા-હઝા કીજિયે યુનાન્યે બાબુલ મદીના કરાચી કે એક ઈસ્લામી ભાઈ કી તહરીર બિતસરુફ પેશ કરતા હું : અફસોસ ! મેરી પિછલી ઝિન્દગી સપ્ત ગુનાહોં મેં ગુઝરી, મેં પતંગ બાઝી કા શૌકીન થા નીઝ વિડિયો ગેમ્ઝ ઓર ગોલિયાં ખેલના વગૈરા મેરે મશાગિલ મેં શામિલ થા. હર એક કે મુઆ-મલે મેં ટાંગ અડાના, ખ્વાહ મ ખ્વાહ લોગોં સે લડાઈ મોલ લેના, બાત બાત પર મારઘાડ પર ઉતર આના વગૈરા મેરે મા'મૂલાત થે. ખુશ કિસ્મતી સે એક ઈસ્લામી ભાઈ કી ઈન્ફિરાદી કોશિશ પર મેં ૨-મઝાનુલ મુબારક કે આબિરી અ-શરે મેં અલાકે કી મસ્જિદ મેં મો'તકિફ હો ગયા. મુઝે બહુત અચ્છે અચ્છે ખ્વાબ નઝર આએ ઓર ખૂબ સુકૂન મિલા. મેં ને મઝીદ દો સાલ એ'તિકાફ કી સઆદત હાસિલ કી. એક બાર હમારી મસ્જિદ કે મુઅઝ્ઝન સાહિબ ઈન્ફિરાદી કોશિશ કર કે મુઝે તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક, દા'વતે ઈસ્લામી કે આલમી મ-દની મર્કઝ ફૈઝાને મદીના મેં હફતાવાર સુન્નતોં ભરે ઈજતિમાઅ મેં લે આએ. એક મુબલિગ બયાન કર રહે થે,

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ : જો શપ્સ મુઝ પર દુરૂદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (બ્રહ્મ)

સફેદ લિબાસ ઓર કથ્થઈ ચાદર મેં મલ્બૂસ, ચેહરે પર એક મુશ્ત દાઢી ઓર સર પર ઈમામા શરીફ કે તાજ વાલા એસા બા રૌનક ચેહરા મેં ને ઝિન્દગી મેં પહલી બાર હી દેખા થા. મુબલ્લિગ કે ચેહરે કી કશિશ ઓર નૂરાનિચ્ચત ને મેરા દિલ મોહ લિયા ઓર મેં દા'વતે ઈસ્લામી કે મ-દની માહોલ મેં આ ગયા ઓર અબ (તા દમે તહરીર) દો સાલ સે આલમી મ-દની મર્કઝ ફેઝાને મદીના (બાબુલ મદીના) હી મેં એ'તિકાફ કરતા હૂં. اَلْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ મેં ને એક મુઠ્ઠી દાઢી ભી સજા લી હે.

(ફેઝાને સુન્નત, જિ. 1, સ. 1379, બિ તગથ્યુરે કલીલ)

મસ્ત હર દમ રહૂં મેં દે દે ઉલ્ફત કા જામ યા અલ્લાહ

ભીક દે દે ગમે મદીના કી બહરે શાહે અનામ યા અલ્લાહ

صَلُّوْا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

100  
એક યુપ સો સુખ

તાલિબે ગમે મદીના વ  
બકીઅ વ મગ્ફિરત વ  
બે હિસાબ જન્નતુલ  
ફિરદૌસ મેં આકા  
કા પડોસ



25 જુમાદલ ઉખરા 1434 સિ.હિ.

06-05-2013

ચેહ રિસાલા પઢ કર દૂસરે કો દે દીજિયે

શાદી ગમી કી તક્રીબાત, ઈજતિમાઆત, આ'રાસ ઓર જુલૂસે મીલાદ વગૈરા મેં મક-ત-બતુલ મદીના કે શાએઅ કર્દા રસાઈલ ઓર મ-દની ફૂલોં પર મુશ્તમિલ પેફ્લેટ તક્સીમ કર કે સવાબ કમાઈયે, ગાહકોં કો બ નિચ્ચતે સવાબ તોહફે મેં દેને કે લિયે અપની દુકાનોં પર ભી રસાઈલ રખને કા મા'મૂલ બનાઈયે, અખ્બાર ફરોશોં યા બચ્ચોં કે ઝરીએ અપને મહલ્લે કે ઘર ઘર મેં માહાના કમ અઝ કમ એક અદદ સુન્નતોં ભરા રિસાલા યા મ-દની ફૂલોં કા પેફ્લેટ પહોંચા કર નેકી કી દા'વત કી ધૂમેં મચાઈયે ઓર ખૂબ સવાબ કમાઈયે.



کرمانہ میں مستحق: صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: جس کے پاس میرا ایک ڈوا اور اُس نے مجھ پر دُرُودِ پاک نہ پڑھا تو اس کی کھوپڑی بڑھ بڑھ کر گئی۔ (ابن سنی)

## ڈیٹریس

عنوان	صفحہ	عنوان	صفحہ
دُرُودِ شَرِیْکِ کِی کُڑی لیت	1	ڈوا کی ڈیٹریس سے ڈوا کتے	12
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ	1	بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ کی ڈیٹریس	12
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ کے کُڑی لیتے ہوئے!	2	مُحَمَّدِی کِی کُڑی لیتے ہوئے	14
پتنگ اُڑانے، پتنگ لڑانے، پتنگ اُڑانے اور ڈور		مُحَمَّدِی کِی کُڑی لیتے ہوئے پر کُڑی لیتے ہوئے	15
لُڑنے اور کُڑنے کا شَر-عِی ڈیٹریس	3	ڈوا کتے کے کُڑی لیتے ہوئے	16
پتنگ اُڑانے کے کُڑی لیتے ہوئے	4	ڈوا کتے کے کُڑی لیتے ہوئے	16
پتنگ اُڑانے سے ڈور لیتے ہوئے	5	ڈوا کتے کے کُڑی لیتے ہوئے	17
پتنگ اُڑانے کے کُڑی لیتے ہوئے	6	ڈوا کتے کے کُڑی لیتے ہوئے	17
پتنگ لُڑنے کے کُڑی لیتے ہوئے	8	ڈوا کتے کے کُڑی لیتے ہوئے	18
ایک ڈیٹریس لیتے ہوئے	9	ڈوا کتے کے کُڑی لیتے ہوئے	18
6 برس میں پتنگ اُڑانے سے 825 اُڑانے	10	ڈوا کتے کے کُڑی لیتے ہوئے	19
2013 ع. میں پتنگ اُڑانے کے کُڑی لیتے ہوئے		ڈوا کتے کے کُڑی لیتے ہوئے	20
مُحَمَّدِی کُڑی لیتے ہوئے	10	پتنگ اُڑانے کے کُڑی لیتے ہوئے	21

## مآخذ و مراجع

مطبوعہ	کتاب	مطبوعہ	کتاب
مرکز اہلسنت برکات رضا اہلند	شرح الصدور	مکتبہ المدینہ باب المدینہ کراچی	قرآن مجید
دار المعرفہ بیروت	الزواجر	مکتبہ المدینہ باب المدینہ کراچی	خزائن العرفان
پشاور	کتاب الکبائر	پیر بھائی کھنٹی مرکز الاولیاء لاہور	نور العرفان
مکتبہ المدینہ باب المدینہ کراچی	تہتم میں لے جانے والے اعمال	دار الفکر بیروت	مشہد امام احمد
دار المعرفہ بیروت	رد المحتار	دار الکتب العلمیہ بیروت	معجم اوسط
رضا فاؤنڈیشن مرکز الاولیاء لاہور	فتاویٰ رضویہ	دار الفکر بیروت	فردوس الاخبار
مکتبہ المدینہ باب المدینہ کراچی	اسلامی زندگی	دار الکتب العلمیہ بیروت	مشہد العابدین

## मुसीबत ऋदा को दैज कर पढने की दुआ

करमाने मुस्तफा : ﷺ ﷻ : जे शप्स किसी मुब्तलाओ बला को दैज कर येह दुआ पढ ले :

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ عَلَّمَنِ مَا اَبْلَاكَ بِهِ، وَفَضَّلَنِيْ عَلٰى كَثِيْرٍ مِّمَّنْ خَلَقَ فَفَضَّلَنِيْ.  
 ती वोह उस बला से मलकुज रहेगा. (रमदी हदीथ ३४४३)

छजरते मुफती अहमद यार पान एसे उन्मल्लेन एसे छदीसे पाक के तहत विपते हँ : बला प्वाह जिस्मानी छो जैसे कोठ, अन्धा पन या और कोई बीमारी, माखी जैसे कर्ज, ककर, तंगिये रिजुक वगैरा, या दीनी जैसे कुक, फिस्क, जुल्म, बिदूअत वगैरा गरज के छर मुसीबत के विये येह ईकसीर है. (समतसरात) येह दुआ अहुत आछिस्ता कहे के वोह मुसीबत जदा न सुने, (उसे रन्ज होगा. (समत) (मिरआत, जि. 4, स. 38) मेरे आका आ'ला छजरत एसे उन्मल्लेन एसे विपते हँ : तीन<sup>३</sup> किस्म की बीमारियों (1) जुकाम (2) फुजली और (3) आशोबे यश्म में मुब्तला को दैज कर येह दुआ न पढी ज्ञाने.

(मलकुजते आ'ला छजरत, स. 70 मुवप्पसन)



**मक-त-अलुल मदीना**

दा'वते इस्लामी

देवाणे मदीना, सी डोनेरिया बन्गीये के सामने, मिराजपुर, अहमदसाबाद, गुजरात, इन्डिया  
 Mo.091 93271 68200 E-mail : maktabahmedabad@gmail.com www.dawateislami.net